



AAK-002-001405 Seat No. _____

B. Com. (Sem. IV) (CBCS) Examination

March / April - 2016

**Corporate Accounting - II
(Core - VIII) (New Course)**

Faculty Code : 002

Subject Code : 001405

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

૧ MCQs :

૨૦

(૧) નીચેનામાંથી કઈ યોગ્યતા ધરાવતી મિલકત છે ?

- (A) ઉત્પાદન પ્લાન્ટ (B) પાવર ઉત્પન્ન કરવાની સવલત
(C) માલનો સ્ટોક (D) ઉપરના ત્રણેય

(૨) આંતર-કંપની દેવાદારો-લેણદારો :

- (A) રદ કરાય છે. (B) આગળ લઈ જવાય છે.
(C) પા.સ.માં દર્શાવાય છે. (D) ઉપરમાંથી કંઈ નહિ

(૩) AS-17 તરીકે ઓળખાય છે -

- (A) શેરદીઠ કમાણી
(B) ભાડાપટ્ટાના હિસાબો
(C) સંબંધ ધરાવતા પક્ષકારો અંગે પ્રગટીકરણ
(D) વિભાગીય અહેવાલની રજૂઆત

(૪) સંયોજન, સમાવેશ અને પુનઃરચનાની બાબતમાં, ઓછામાં ઓછી _____ કંપનીનું વિસ્ફોટ થાય છે.

- (A) એક (B) બે
(C) ત્રણ (D) ચાર

- (પ) નીચેનો કયો સંબંધ ધરાવતા પક્ષકારનો વ્યવહાર નાણાકીય પત્રકોમાં દર્શાવાય છે.
- (A) માલની ખરીદી કે વેચાણ (B) સ્થિર મિલકતોની ખરીદી કે વેચાણ
(C) ભાડાપટ્ટા કે ભાડે ખરીદી (D) ઉપરના બધા વ્યવહારો
- (દ) જ્યારે ખરીદ કિંમત ચોખ્ખી મિલકતો કરતાં વધુ હોય ત્યારે તફાવત -
- (A) પાઘડી (B) મૂડી અનામત
(C) સામાન્ય અનામત (D) ઉપરનામાંથી કોઈ નહિ
- (૭) શેરદીઠ કમાણી એટલે -
- (A) AS-17 (B) AS-18
(C) AS-19 (D) AS-20
- (૮) આકસ્મિક જવાબદારી ચૂકવાઈ ત્યારે આપણે ઉધારીએ -
- (A) પાઘડી ખાતું (B) આકસ્મિક જવાબદારીનું ખાતું
(C) બેન્ક ખાતું (D) મૂડી ઘટાડા ખાતું
- (૯) AS-17માં સમાવેશ થતો નથી -
- (A) મૂડી વિભાગ (B) ભૌગોલિક વિભાગ
(C) વિભાગીય મિલકતો (D) વિભાગીય જવાબદારીઓ
- (૧૦) કઈ બાબતમાં માલ-મિલકત નિકાલ ખાતાને બે ભાગમાં વહેંચવામાં આવે છે ?
- (A) સંયોજન (B) મૂડી ઘટાડો
(C) પુનઃરચના (D) સમાવેશ
- (૧૧) AS-16 સંબંધિત છે -
- (A) સ્થિર મિલકતો (B) સંબંધ ધરાવતા પક્ષકારોનું પ્રગટીકરણ
(C) વિભાગીય અહેવાલ (D) નાણાં ઉછીના લેવાની પડતર
- (૧૨) મૂડી ઘટાડાની યોજના પૂરી થયા બાદ, બાકીની રકમ ક્યા ખાતે લઈ જવાય છે ?
- (A) નફા-નુકસાન ખાતે (B) સામાન્ય અનામત ખાતે
(C) મૂડી અનામત ખાતે (D) પાઘડી ખાતે

(૧૩) AS-18નું નામ જણાવો.

- (A) નાણાં ઉછીના લેવાની પડતર
- (B) વિભાગીય અહેવાલ
- (C) સંબંધ ધરાવતા પક્ષકારો
- (D) શેરદીઠ કમાણી

(૧૪) જ્યારે ખરીદ કિંમત ચોખ્ખી મિલકતો કરતા ઓછી હોય ત્યારે તફાવત -

- (A) પાઘડી
- (B) મૂડી અનામત
- (C) સામાન્ય અનામત
- (D) ઉપરનું એક પણ નહિ

(૧૫) શેરદીઠ કમાણીના હિસાબી ધોરણમાં કેટલા પ્રકારની શેરદીઠ કમાણી આપેલ છે ?

- (A) બે
- (B) ત્રણ
- (C) ચાર
- (D) પાંચ

(૧૬) ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ચૂકવે ત્યારે તેને -

- (A) પાઘડીમાં ઉમેરાય છે.
- (B) પાઘડીમાંથી બાદ કરાય છે.
- (C) મૂડી અનામતમાં ઉમેરાય છે.
- (D) કોઈ અસર નથી અપાતી.

(૧૭) AS-19 સંબંધિત છે -

- (A) વિભાગીય અહેવાલ
- (B) શેરદીઠ કમાણી
- (C) ભાડાપટ્ટાના હિસાબો
- (D) સંબંધ ધરાવતા પક્ષકારો

(૧૮) જો શેરના આંતરિક મૂલ્યની રકમ ખૂટતી હોય તો તે કયા સ્વરૂપમાં ચૂકવાય છે ?

- (A) ઈક્વિટી શેર
- (B) પ્રેફરન્સ શેર
- (C) ડિબેન્ચર્સ
- (D) રોકડ

(૧૯) ભાડાપટ્ટાના પ્રકાર કેટલા ?

- (A) બે
- (B) ત્રણ
- (C) ચાર
- (D) પાંચ

(૨૦) ચોખ્ખી મિલકત અને ખરીદ કિંમત સરખી હોય ત્યારે નીચેની કઈ બાબત ઉદ્ભવે ?

- (A) પાઘડી
- (B) મૂડી અનામત
- (C) (A) અને (B) બન્ને
- (D) (A) અને (B)માંથી એક પણ નહિ

૨ વરૂણ લિમિટેડ અને આલ્યા લિમિટેડના તા. ૩૧-૩-૨૦૧૬ના રોજના
પાકાં સરવૈયાં નીચે મુજબ છે :

૧૫

જવાબદારીઓ	વરૂણ લિ. રૂ.	આલ્યા લિ. રૂ.	મિલકતો	વરૂણ લિ. રૂ.	આલ્યા લિ. રૂ.
ઈ. શેરમૂડી દરેક રૂ. ૧૦નો	૨,૦૦,૦૦૦	૧,૨૫,૦૦૦	મકાન ફેન્ચાઈઝી	૧,૬૨,૫૦૦ ૧૨,૫૦૦	૫૦,૦૦૦ ૧૨,૫૦૦
સામાન્ય અનામત	૫૦,૦૦૦	૩૭,૫૦૦	મશીનરી	૬૨,૫૦૦	૨૫,૦૦૦
જામીનગીરી પ્રીમિયમ	૧૨,૫૦૦	૧૨,૫૦૦	રોકાણો	૧૨,૫૦૦	૧૨,૫૦૦
ન.નુક્સાન ખાતું	૨૫,૦૦૦	૨૫,૦૦૦	સ્ટોક	૬૨,૫૦૦	૫૦,૦૦૦
પ્રોવિડન્ટ ફંડ	૫૦,૦૦૦	૨૫,૦૦૦	દેવાદારો	૧૦,૦૦૦	૧૨,૫૦૦
લેણદારો	૬૨,૫૦૦	૨૫,૦૦૦	રોકડ	૮૫,૦૦૦	૧,૦૦,૦૦૦
લેણી હૂંડીઓ	૩૦,૦૦૦	૨૫,૦૦૦	પ્રાથમિક ખર્ચા	૧૨,૫૦૦	૧૨,૫૦૦
	૪,૩૦,૦૦૦	૨,૭૫,૦૦૦		૪,૩૦,૦૦૦	૨,૭૫,૦૦૦

જૂની કંપનીઓનો ધંધો ખરીદી લેવા માટે નવી કંપની 'સ્ટુડન્ટ' લિમિટેડની રચના કરવાનું નક્કી થયું. નવી કંપની રૂ. ૧૦નો એક એવા રૂ. ૫,૦૦,૦૦૦ની સત્તાવાર મૂડી સાથે સ્થાપવામાં આવી. તેણે જૂની કંપનીઓની બધી મિલકતો અને દેવાં લઈ લેવાં. ખરીદીની શરતો નીચે મુજબ છે :

- (૧) સ્થિર મિલકતોની બજાર કિંમત ચોપડે કિંમત કરતા ૨૦% વધુ છે.
- (૨) રોકાણો લેવાના નથી. રોકાણો વેચી દેવામાં આવ્યા.
- (૩) બધી ચાલુ મિલકતો ચોપડે કિંમત બાદ ૨૦%થી લેવાની છે.
- (૪) અદૃશ્ય અને અવાસ્તવિક મિલકતો લેવાની નથી.
- (૫) ખરીદ કિંમત નવી કંપનીના ઈ. શેરની સામે ચૂકવવાની છે.
- (૬) નવી કંપનીના બાકીના ઈ. શેર જાહેર જનતા માટે ૧૦% પ્રીમિયમથી બહાર પાડ્યા.
- (૭) ૩૦,૦૦૦ અને ૧૫,૦૦૦ ઈ. શેર અનુક્રમે જૂની કંપનીઓને આપવામાં આવ્યા.

તૈયાર કરો :

- (૧) સ્ટુડન્ટ કંપનીનું પાકું સરવૈયું
- (૨) આલ્યા લિમિટેડના ચોપડે માલ-મિલકત નિકાલ ખાતું.

અથવા

૨ પ્રશ્ન નં. ૨માં આપેલ પાકાં સરવૈયાં અને વધારાની માહિતી પરથી વરૂણ ૧૫ લિમિટેડના ચોપડે માલ-મિલકત નિકાલ ખાતું અને ઈકિવિટી શેરહોલ્ડરોનું ખાતું તૈયાર કરો.

૩ દિપિકા લિમિટેડનું તા. ૩૧-૩-૨૦૧૬ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે : ૧૫

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
ઈ. શેર દરેક રૂ. ૧૦નો તેવા	૨,૦૦,૦૦૦	મકાન	૧,૬૨,૫૦૦
પ્રેફ. શેર રૂ. ૧૦નો તેવા	૫૦,૦૦૦	ફેન્યાઈઝી	૧૨,૫૦૦
૧૦% ડિબેન્ચર્સ	૫૦,૦૦૦	મશીનરી	૬૨,૫૦૦
પ્રોવિડન્ટ ફંડ	૫૦,૦૦૦	ટેક. શોધ-ખોળ	૧૨,૫૦૦
લેણદારો	૫૦,૦૦૦	સ્ટોક	૬૨,૫૦૦
લેણી હૂંડીઓ	૩૦,૦૦૦	દેવાદારો	૧૦,૦૦૦
		નફા નુક્સાન ખાતું	૮૫,૦૦૦
		જાહેરાત ઝુંબેશ	૧૨,૫૦૦
	૪,૩૦,૦૦૦		૪,૩૦,૦૦૦

નીચે મુજબની મૂડી ઘટાડાની યોજના કોર્ટ દ્વારા મંજૂર થઈ :

- (૧) ઈ. શેરમૂડી શેરદીઠ રૂ. ૫થી ઘટાડવી.
 - (૨) પ્રેફરન્સ શેર મૂડી રૂ. ૨૫,૦૦૦ સુધી રદ કરવી.
 - (૩) ડિબેન્ચરહોલ્ડર્સ તેઓનું દેવું રૂ. ૨૫,૦૦૦થી જતું કરવા તૈયાર થયા છે.
 - (૪) લેણદારો રૂ. ૨૫,૦૦૦ જતા કરવા તૈયાર છે.
 - (૫) સ્થિર મિલકતો ૮૦%થી પુનઃઆકારણી કરવી.
 - (૬) બધી જ અદૃશ્ય અને અવાસ્તવિક મિલકતો લખી વાળવી.
- કંપનીના ચોપડે આમનોંધો લખો.

અથવા

૩ પ્રશ્ન નં. ૩માં આપેલ દિપિકા લિમિટેડના પાકાં સરવૈયાં અને વધારાની માહિતી પરથી મૂડી ઘટાડાની યોજનાના અમલ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. ૧૫

૪ કેટ્રીના અને રણબીર લિમિટેડના તા. ૩૧-૩-૨૦૧૬ના રોજના પાકાં સરવૈયાં ૧૦
નીચે મુજબ છે :

જવાબદારીઓ	કેટ્રીના લિ. રૂ.	રણબીર લિ. રૂ.	મિલકતો	કેટ્રીના લિ. રૂ.	રણબીર લિ. રૂ.
ઈ. શેરમૂડી દરેક રૂ. ૧૦નો	૨,૦૦,૦૦૦	૧,૨૫,૦૦૦	પાઘડી	૧૨,૫૦૦	૧૨,૫૦૦
પ્રેફ. શેર રૂ. ૧૦નો			મકાન	૧,૬૨,૫૦૦	૫૦,૦૦૦
તેવા	-	૫૦,૦૦૦	મશીનરી	૬૨,૫૦૦	૨૫,૦૦૦
અનામત - વધારો	૫૦,૦૦૦	૨૫,૦૦૦	રોકાણો	-	૧૨,૫૦૦
૧૨% ડિબેન્ચર્સ	૫૦,૦૦૦	-	વાણિજ્યક		
પ્રોવિડન્ટ ફંડ	૫૦,૦૦૦	૨૫,૦૦૦	અધિકારો	૧૨,૫૦૦	-
લેણદારો	૫૦,૦૦૦	૨૫,૦૦૦	સ્ટોક	૬૨,૫૦૦	૫૦,૦૦૦
લેણી હૂંડીઓ	૩૦,૦૦૦	૨૫,૦૦૦	દેવાદારો	૧૦,૦૦૦	૧૨,૫૦૦
			રોકડ-બેન્ક	૮૫,૦૦૦	૧,૦૦,૦૦૦
			પ્રસારિત		
			અસ્કયામત	૧૨,૫૦૦	૧૨,૫૦૦
	૪,૩૦,૦૦૦	૨,૭૫,૦૦૦		૪,૩૦,૦૦૦	૨,૭૫,૦૦૦

રણબીર લિમિટેડ કેટ્રીના લિમિટેડને નીચેની શરતોએ સમાવી લીધી :

- (૧) બધી જ દશ્ય મિલકતો ૧૦% વધુ કિંમતે તેમજ ચાલુ મિલકતો લઈ લીધી.
 - (૨) બધી જ ચાલુ જવાબદારીઓ ૧૦% વટાવથી સમાવી લીધી.
 - (૩) કેટ્રીના લિમિટેડના ડિબેન્ચરહોલ્ડરોને રણબીર લિમિટેડના ૧૦% ડિબેન્ચર્સ એટલી કિંમતે આપવાના હતા કે જેથી તેઓને સમાન વ્યાજ મળતું રહે.
 - (૪) કેટ્રીના લિમિટેડના ઈ. શેરહોલ્ડરોને રણબીર લિમિટેડના ૨૫,૦૦૦ ઈક્વિટી શેર તથા ૫,૦૦૦ પ્રેફરન્સ શેર દરેક રૂ. ૧૦નો તેવા આપવાના હતાં.
- રણબીર લિમિટેડના ચોપડે સમાવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો.

અથવા

૪ પ્રશ્ન નં. ૪માં આપેલ પાકાં સરવૈયાં અને વધારાની માહિતીના આધારે ૧૦
કેટ્રીના લિમિટેડના ચોપડે માલ-મિલકત નિકાલ ખાતું તૈયાર કરો.

૫ અનુષ્ઠા લિમિટેડનું તા. ૩૧-૩-૨૦૧૬ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે : ૧૦

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
ઈ. શેર દરેક રૂ. ૧૦નો તેવા	૨,૦૦,૦૦૦	મકાન	૧,૬૨,૫૦૦
૧૦% પ્રેફ. શેર દરેક		મશીનરી	૬૨,૫૦૦
રૂ. ૧૦નો	૫૦,૦૦૦	રોકાણો	૧૨,૫૦૦
મૂડી અનામત	૫૦,૦૦૦	વેપારી-પરવાના	૧૨,૫૦૦
પ્રોવિડન્ટ ફંડ	૫૦,૦૦૦	સ્ટોક	૬૨,૫૦૦
લેણદારો	૫૦,૦૦૦	દેવાદારો	૧૦,૦૦૦
દેવી હૂંડીઓ	૩૦,૦૦૦	નફા નુકસાન ખાતું	૮૫,૦૦૦
		રોકડ	૧૨,૫૦૦
	૪,૩૦,૦૦૦		૪,૩૦,૦૦૦

નીચે મુજબની પુનઃરચનાની એક યોજના સ્વીકારવામાં આવી :

- (૧) સુશાંત લિમિટેડ નામની કંપની, અનુષ્ઠા લિમિટેડની મિલકતો અને દેવાં લઈ લેવા, સ્થાપવામાં આવે.
- (૨) સુશાંત લિમિટેડની સત્તાવાર શેરમૂડીમાં ૨૦,૦૦૦ ઈક્વિટી શેર અને ૧૦,૦૦૦ પ્રેફરન્સ શેર દરેક રૂ. ૧૦નો સમાવેશ થશે.
- (૩) અનુષ્ઠા લિમિટેડના ઈ. શેરહોલ્ડરોને પાંચ ઈક્વિટી શેરની સામે નવી કંપનીના ત્રણ ઈક્વિટી શેર આપવાના હતાં.
- (૪) પ્રેફરન્સ શેરહોલ્ડરોને પાંચ પ્રેફરન્સ શેરના બદલામાં સુશાંત લિમિટેડના ચાર પ્રેફરન્સ શેર આપવાના હતાં.
- (૫) નફા-નુકસાન ખાતું અને અદૃશ્ય મિલકતો લખી વાળવાની હતી.
- (૬) મકાનની કિંમતમાં જરૂરી ઘટાડો કરવાનો હતો.
- (૭) ડિબેન્ચરહોલ્ડર્સ તેનું ૫૦% દેવું જતું કરશે.

અનુષ્ઠા લિ.ના ચોપડે માલ-મિલકત નિકાલ ખાતું તૈયાર કરો.

અથવા

- ૫ પ્રશ્ન પમાં આપેલ અનુષ્ઠા લિમિટેડના પાકાં સરવૈયાં અને વધારાની માહિતી ૧૦
પરથી, સુશાંત લિમિટેડનું પાકું સરવૈયું તૈયાર કરો.

ENGLISH VERSION

- 1 MCQ : 20

- (1) Which of following is qualifying asset ?
- (A) Manufacturing plant
(B) Power generating facility
(C) Inventory
(D) All of the above three
- (2) Inter-company debtors and creditors are -
- (A) Cancelled (B) Carried forward
(C) Shown in new B/s (D) None of the above
- (3) AS-17 is known as -
- (A) Earning per share
(B) Lease Accounting
(C) Related party disclosure
(D) Segment reporting
- (4) In case of Amalgamation, Absorption and Reconstruction at least _____ company.
- (A) one (B) two
(C) three (D) four

- (5) Which of the following transaction with related party should be disclosed in the financial statements ?
- (A) Purchase or sale of goods
 (B) Purchase or sale of fixed assets
 (C) Leasing or higher purchase
 (D) All of the above
- (6) What is difference, when, purchase consideration is greater than net asset ?
- (A) Goodwill (B) Capital Reserve
 (C) General Reserve (D) None of the above
- (7) Earning per share is -
- (A) AS-17 (B) AS-18
 (C) AS-19 (D) AS-20
- (8) When contingent liability is paid, we debit -
- (A) Goodwill A/c (B) Contingent Liability A/c
 (C) Bank A/c (D) Capital Reduction A/c
- (9) AS-17 does not include -
- (A) Capital segment (B) Geographical segment
 (C) Segment asset (D) General liabilities
- (10) Some time realization A/c is split into two accounts, in case of -
- (A) Amalgamation (B) Capital Reduction
 (C) Reconstruction (D) Absorption
- (11) AS-16 is related to -
- (A) Fixed asset (B) Related party disclosure
 (C) Segment reporting (D) Borrowing cost
- (12) After completion of scheme of capital reduction, balance is transferred to -
- (A) P & L A/c
 (B) General Reserve A/c
 (C) Capital Reserve A/c
 (D) Goodwill A/c

- (13) Name the AS-18 -
(A) Borrowing cost
(B) Segment Reporting
(C) Related party disclosure
(D) Earning per share
- (14) When purchase consideration is less than net assets difference is -
(A) Goodwill (B) Capital reserve
(C) General reserve (D) None of the above
- (15) How many types of EPS are mentioned in AS for EPS ?
(A) Two (B) Three
(C) Four (D) Five
- (16) If purchasing Co. has agreed to pay liquidation expense, if will be -
(A) Added to goodwill
(B) Deducted from goodwill
(C) Added to capital reserve
(D) No effect
- (17) AS-19 is related to -
(A) segment reporting
(B) earning per share
(C) lease accounting
(D) related party disclosure
- (18) If the intrinsic values of shares exchanged are not equal, the difference is given in -
(A) equity shares (B) pref. shares
(C) debentures (D) cash
- (19) How many types of lease are there ?
(A) two (B) three
(C) four (D) five
- (20) What does following arise in case of net assets and purchase consideration are same ?
(A) Goodwill (B) Capital reserve
(C) Both (A) and (B) (D) None of (A) and (B)

2 Balance Sheets of Varun Ltd. and Alya Ltd. are as under 15
as on 31-3-2016 :

<i>Liabilities</i>	<i>Varun Ltd. Rs.</i>	<i>Alya Ltd. Rs.</i>	<i>Assets</i>	<i>Varun Ltd. Rs.</i>	<i>Alya Ltd. Rs.</i>
Eq. shares of Rs. 10 each	2,00,000	1,25,000	Buildings	1,62,500	50,000
General reserve	50,000	37,500	Franchises	12,500	12,500
Sec. Premium	12,500	12,500	Machinery	62,500	25,000
P and L A/c	25,000	25,000	Investments	12,500	12,500
Provident fund	50,000	25,000	Stock	62,500	50,000
Creditors	62,500	25,000	Debtors	10,000	12,500
Bills payable	30,000	25,000	Cash	95,000	1,00,000
			Preliminary exp.	12,500	12,500
	4,30,000	2,75,000		4,30,000	2,75,000

It is decided to form new company called "Student" Ltd. to take over both the companies, New company is to be incorporated with equity share capital of Rs. 5,00,000 of Rs. 10 each. It would acquire all assets and liabilities of old companies. Terms of acquisition are as under.

- (1) Market value of fixed assets is 20% more than its book value.
- (2) Investments are not to be taken over which will be sold out.
- (3) All current assets are taken over at book value less 20%.
- (4) Intangible assets and fictitious assets would not be taken.
- (5) Purchase consideration is to be met against equity shares of new company.
- (6) The rest eq. shares of new co. are issue for public subscription at 10% premium.
- (7) 30,000 and 15,000 shares are issued respectively to old companies.

You are required to prepare :

- (1) Balance Sheet of 'Student' Company.
- (2) Realization A/c in the books of Alya Ltd..

OR

- 2** From the Balance Sheets and other information given **15**
in Question No. 2 prepare :

Realization A/c and Shareholders A/c in the books of
Varun Ltd.

- 3** Balance Sheet of Dipika Ltd. as on 31-3-16 is given below : **15**

Balance Sheet of Dipika

<i>Liabilities</i>	<i>Rs.</i>	<i>Assets</i>	<i>Rs.</i>
Eq. share of Rs. 10 each	2,00,000	Buildings	1,62,500
Pref. share of Rs. 10 each	50,000	Franchises	12,500
10% Debentures	50,000	Machinery	62,500
Provident fund	50,000	Know-how	12,500
Creditors	50,000	Stock	62,500
Bills payable	30,000	Debtors	10,000
		P & L A/c	95,000
		Adv. Campaign A/c	12,500
	4,30,000		4,30,000

A scheme of capital reduction as mentioned below is approved
by court :

- (1) Eq. share capital is reduced by Rs. 5 per share.
- (2) Pref. share capital is to eliminate to Rs. 25,000.
- (3) Debentureholders are agreed to waive their debt by
Rs. 25,000.
- (4) Creditors are ready to forgo Rs. 25,000.

- (5) Fixed assets are revalued at 90%.
- (6) All intangible and fictitious assets are to be written off.

You are required to write Journal Entries in the Books of Company.

OR

3 From the Balance Sheet of Dipika Ltd. and other **15**
Information given in Question No. 3 prepare Balance Sheet after giving effect of scheme of Capital Reduction.

4 Balance Sheets of Katrina Ltd. and Ranbir Ltd. as on **10**
31-3-2016 as under :

<i>Liabilities</i>	<i>Katrina Ltd. Rs.</i>	<i>Ranbir Ltd. Rs.</i>	<i>Assets</i>	<i>Katrina Ltd. Rs.</i>	<i>Ranbir Ltd. Rs.</i>
Eq. share of Rs. 10 each	2,00,000	1,25,000	Goodwill	12,500	12,500
Pref. share of Rs. 10 each	-	50,000	Building	1,62,500	50,000
Reserve & surplus	50,000	25,000	Machinery	62,500	25,000
12% Debentures	50,000	-	Investments	-	12,500
Prov. fund	50,000	25,000	Commercial rights	12,500	-
Creditors	50,000	25,000	Stock	62,500	50,000
Bills payable	30,000	25,000	Debtors	10,000	12,500
			Cash - bank	95,000	1,00,000
			Deferred assets	12,500	12,500
	4,30,000	2,75,000		4,30,000	2,75,000

Ranbir Ltd. absorbed Katrina Ltd. on following terms :

- (1) All tangible assets at 10% higher and current assets were to be taken over.
- (2) All current liabilities were taken at 10% discount.

- (3) Debentureholders of Katrina Ltd. would be issued 10% debentures of Ranbir Ltd. at such price so as they would receive same interest.
- (4) Equity shareholder's of Katrina Ltd. were to be allotted 25,000 equity shares and 5,000. 10% pref. shares of Rs. 10 each of Ranbir Ltd.

You are required to prepare B/s of Ranbir Ltd. after absorption.

OR

- 4 From the B/s and other information given in Question No. 4, prepare realization A/c in the books of Katrina Ltd. **10**
- 5 Balance Sheet of Anushka Ltd. as on 31-3-2016 is as under : **10**

<i>Liabilities</i>	<i>Rs.</i>	<i>Assets</i>	<i>Rs.</i>
Eq. share of Rs. 10 each	2,00,000	Buildings	1,62,500
10% pref. share of		Machinery	62,500
Rs. 10 each	50,000	Investments	12,500
Capital reserve	50,000	Trade licences	12,500
Provident fund	50,000	Stock	62,500
Creditors	50,000	Debtors	10,000
Bills payable	30,000	P and L A/c	95,000
		Cash	12,500
	4,30,000		4,30,000

A scheme of reconstruction was adopted as following :

- (1) A new company Sushant Ltd. was to be formed to take over assets and liabilities of Anushka Ltd.
- (2) Authorised share capital of Sushant Ltd. would consist of 20,000 equity share and 10,00 pref. share of Rs. 10 each.

- (3) Equity shareholders would be given 3 shares of 10 each fully paid of Shushant Ltd. for 5 shares held in Anushka Ltd.
- (4) Pref. shareholders were to be allotted 4 pref. shares of new company for every 5 shares held in old company.
- (5) P and L A/c and intangible assets would be written off.
- (6) Reduction as required in the value of building would be made.
- (7) Debentureholders would give up 50% their due.

You are required to prepare realisation A/c in the books of Anushka Ltd.

OR

- 5** From the Balance Sheet of Anushka Ltd. and additional information given in Question No. 5, prepare Balance Sheet of Sushant Ltd. **10**